



RAN-2308000106051003

T. Y. B. Com. (Sem. - VI) Examination October - 2025
Indian Banking and Currency (Paper - VII)

Time: 2 Hours]

[Total Marks: 50

સૂચના : / Instructions

- (1) ઉપરોક્ત દર્શાવેલ વિગતો ઉત્તરવહી પર અવશ્ય લખવી.
 Fill up strictly the above details on your answer book.

Seat No.:

--	--	--	--	--	--

Student's Signature

પ્ર. 1. અ. હેતુલક્ષી પ્રશ્નનો જવાબ આપો.

(15)

Answer Multiple choice Questions.

- રિઝર્વબેંકની સ્થાપના ક્યારે થઈ?
 (A) 1934 (B) 1948
 (C) 1949 (D) 1940
 When was Reserve Bank of India established?
 (A) 1934 (B) 1948
 (C) 1949 (D) 1940
- ટૂંકાગાળાનું ધિરાણ કરતી સંસ્થા એટલે
 (A) મૂડી બજાર (B) નાણા બજાર
 (C) હૂંડી બજાર (D) ફ્યુચર બજાર
 A Short term lending institution means
 (A) Capital Market (B) Money Market
 (C) Hundi Market (D) Future Market
- કઈ બેન્કોની NPA સૌથી વધારે છે.
 (A) ખાનગી બેંક (B) સહકારી બેંક
 (C) જાહેરક્ષેત્રની બેંક (D) વિદેશી બેંક
 Which Bank has highest NPA ?
 (A) Private bank (B) Co-operative Bank
 (C) Public Sector bank (D) Foreign Bank
- તરતા વિનિમયદર પ્રથાના લાભ જણાવો.
 (A) નિકાસને ઉત્તેજન (B) વિદેશી ચલણના અંતરપ્રવાહ
 (C) કાર્યક્ષમતામાં સુધારણા (D) આપેલા તમામ
 Benefit of Floating rate system.
 (A) Promotion of Exports (B) Interflow in foreign currency
 (C) improvement in efficiency (D) All of this
- KYC નું પુરુ નામ જણાવો.
 (A) Key your customer (B) know your company
 (C) know your customer (D) None of this
 Give the Full Form of KYC ?
 (A) Key your customer (B) know your company
 (C) know your customer (D) None of this

6. નીચેનામાંથી કયું મૂડીબજારનું સાધન નથી?

- (A) પ્રોમિસરી નોટ (B) વિનિમય પત્રો
(C) વેપારી બિલો (D) આપેલ તમામ

Which one is not source of capital market.

- (A) Promissory Note
(B) Bill of Exchange
(C) Trader Bill
(D) All of this

7. રિઝર્વ બેંક ઈન્ડિયા શાખા નિયમન માટે કયા સાધનોનો ઉપયોગ કરે છે?

- (A) પરિમાણાત્મક સાધનો (B) ગુણાત્મક શાખા નિયમનના સાધનો
(C) નૈતિક સમજાવટ અને પતાવટની નીતિ (D) આપેલ તમામ

Which tool are used by reserve bank of India for credit control ?

- (A) Quantitative payments
(B) Qualitative instrument of Regulation
(C) ethical persuasion settlement policy
(D) All of this

8. વર્તમાનમાં ભારતમાં ચલણી નોટ કઈ પદ્ધતિથી બહાર પાડવામાં આવે છે?

- (A) સપ્રમાણ અનામત પદ્ધતિ (B) ન્યૂનતમ અનામત પદ્ધતિ
(C) રોકડ અનામત પદ્ધતિ (D) ઉપરોક્ત પૈકી તમામ

By Which methods are currency notes issued in India at present Time?

- (A) Pro-proportional method
(B) Minimum Reserve method
(C) Cash Reserve method
(D) All of this

9. નવેમ્બર 2016 ના વિમુદ્રીકરણના મુખ્ય કારણો કયા છે?

- (A) કાળુ નાણું (B) નકલી ચલણનું જોખમ
(C) આતંકવાદી પ્રવૃત્તિઓ (D) ઉપરોક્ત પૈકી તમામ

Give the main reasons for Demonetisation in November 2016 ?

- (A) Black Money (B) Counterfeit Notes
(C) Terrasit Activities (D) All of this

10. ભારતમાં નાણાકીય ક્ષેત્રના સુધારાની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી?

- (A) 1992 (B) 1991
(C) 1975 (D) 1935

When did Financial Reforms start in India ?

- (A) 1992 (B) 1991
(C) 1975 (D) 1935

11. મધ્યસ્થ બેંક તરીકે રીઝર્વ બેંક ઈન્ડિયાના પ્રણાલિકાગત કાર્યો....

- (A) ક્લિયરીંગ હાઉસ (B) સરકારની બેંક
(C) અંતિમ સહાયક (D) આપેલ પૈકી બધા જ

Central Bank of India RBI Function

- (A) Central Clearing House (B) Banker to Govt.
(C) Lender of the last resort (D) All of this.

12. આર.બી.આઈ. એક્ટ અન્વયે બેંક રેટ હેઠળ આવરી લે છે.

- (A) સેક્ટર - 46 (B) સેક્ટર - 45
(C) સેક્ટર - 42 (D) સેક્ટર - 44

Which section of Reserve Bank of India act defines bank rate ?

- (A) Section - 46 (B) Section - 45
(C) Section - 42 (D) Section - 44

13. બેંક રેટને રેટ કહેવામાં આવે છે?

(A) વટાવ

(C) રેપો

Bank rate is called as Rate ?

(A) Discount

(C) Repo

(B) બેઝ બેંક

(D) ઉપરમાંથી કોઈ નહિ

(B) Base Bank

(D) None of This

14. NEFT નું સંચાલન કોના દ્વારા થાય છે?

(A) RBI

(C) SBI

Who managed NEFT ?

(A) RBI

(C) SBI

(B) NPCI

(D) UTI

(B) NPCI

(D) UTI

15. કઈ ચુકવણી પ્રણાલીમાં રોજંટી ખરીદી માટે ભૌતિક નાણાનો ઉપયોગ સામેલ છે?

(A) ચેક

(C) રોકડ

Which payment System is Invalid in Physical Money can be used for purchases?

(A) Cheque

(C) Cash

(B) NEFT

(D) NACH

(B) NEFT

(D) NACH

પ્ર. 2. ટૂંકમાં જવાબ આપો (ગમે તે ચાર)
Short Questions (Any Four)

(08)

1. ડિમોનેટાઈઝેશન શા માટે કરવામાં આવ્યું?

Why was the Demonetization?

2. નાણાકીય ક્ષેત્રના મહત્વપૂર્ણ સુધારો એ શું?

What is Significant Monetary Policy Reforms.

3. એન.પી.એ. નું વર્ગીકરણ જણાવો.

Analyses of N.P.A.

4. વિનિમય દર એટલે શું?

What is Exchange Rate ?

5. ચલણમાં ફરતી નકલી નોટો એટલે શું?

What is meant by Counterfeit notes ?

6. નાણાબજાર કયા બે અગત્યના કાર્યો કરે છે?

Which two function of Money Market ?

7. રીઝર્વ બેંકની નાણાકીય નીતિ એટલે શું?

What is meant by monetary policy?

8. રીઝર્વ બેંકના નિરક્ષણવક્ત્રી કાર્યોના માત્ર નામ આપો.

State the supervisory functions of Reserve bank of India.

પ્ર. 3. રિઝર્વ બેંકના વિકાસવક્ત્રી કાર્યો સમજાવો.

Explain the Development function of reserve bank of India.

(13)

અથવા

પ્ર. 3. રીઝર્વ બેંકની નાણાકીય નીતિના મુખ્ય હેતુઓ સમજાવો અને નાણાકીય નીતિનું મૂલ્યાંકન કરો.
Explain the aims of monetary policy of Reserve bank of India ? Evaluate the monetary policy of R.B.I.?

(13)

પ્ર. 4. અ. ટૂંકમાં લખો (ગમે તે બે)

(08)

Short Note (Any Two)

1. ખુલ્લા બજારની નીતિની મર્યાદા
Limitation of Open Market Policy.
2. ન્યૂનતમ અનામત પદ્ધતિ
Minimum Reserve System
3. ભારતીય નાણાબજારની મર્યાદાઓ
Disadvantages of Indian money market.
4. એન.પી.એને અસર કરતા આંતરિક પરિબળો
Factors of responsible for Non-perfuming assets. .

પ્ર. 4. બ. કારણો સમજાવો (ગમે તે બે)

(06)

Give the Reason (any two)

1. કયા કારણોસર નવેમ્બર 2016 માં મોટી ચલણી નોટોનું વિમુદ્રીકરણ કરવામાં આવ્યું.
What Reason large denomination notes were denominated in November 2016 ?
2. રૂપિયાના આંતરિક અને બાહ્ય મૂલ્યની સ્થિરતા જળવાઈ નથી.
Internal and External value of rupees has not been maintained.
3. બેંક રેટનો ઉપયોગ માત્ર કુગાવા વિરોધી નીતિ તરીકે થયો જ છે.
Bank rate has only been used as an anti-inflationary policy.
4. સપ્રમાણ અનામત પદ્ધતિ શા માટે અનુકૂળ થઈ શકી નહીં.
Why proportional reserve system of not issue in India.